https://archive.org/details/bk1418/page/n0/mode/1up

2019-07 -Satpanth Prakash (1418)

All Items on https://archive.org/details/realpatidar

ર્ષ : ૮, અંક : ૭, સળંગ અંક : ૧૦૩, જુલાઈ - ૨૦૧૯
ર માસની પંદર તારીખે પ્રગટ થતું માસિક

Full Library on https://realpatidar.com/library

સત્પંથ પ્રકાશ

શ્રી સત્પંથ બાલ-બાલિકા સુસંસ્કાર શિક્ષણ શિબિર અંક

પ્રેરણાપીઠ-પીરાણા (તા. ૧૬-૫-૨૦૧૯ થી તા. ૨૬-૫-૨૦૧૯)

શ્રી સત્પંથ બાલ-બાલિકા સુસંસ્કાર શિક્ષણ શિબિર

શ્રી સત્પંથ બાલ-બાલિકા સુસંસ્કાર શિક્ષણ શિબિર પ્રસંગે દિપ પ્રાગટ્ય કરી રહેલ
પ.પૂ. જગદ્‌ગુરુશ્રી સત્પંથાચાર્ય નાનકદાસજી મહારાજ, પૂ. મહંતશ્રીઓ, પૂ. સંતો તથા ટ્રસ્ટીશ્રીઓ

છૂટક કિંમત : ૯=૦૦ રૂ. / વા. લ. ૧૦૦=૦૦ રૂ.

realpatidar.com

https://archive.org/details/bk1418/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

Use the Bookmarks facility in the PDF to directly go to the pages containing Highlights.

For Reference See Pages: 2, 3, 22.
For page numbers, see the page footer. Page numbers are in 'Page x of y' format

References by: RealPatidar.com - Created using: step2-QR-and-3-RM-v18.py

https://archive.org/details/bk1418/page/n2/mode/1up

2019-07 -Satpanth Prakash (1418)

Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN,
o=realpatidar.com,
email=mail@realpatidar.com
Reason: I have reviewed this
document
Date: 2026.02.23 15:02:17 +05'30'

realpatidar.com

વર્ષ : ૮, અંક : ૭, સળંગ અંક : ૧૦૩, જુલાઈ - ૨૦૧૯
દર માસની પંદર તારીખે પ્રગટ થતું માસિક

સત્પંથ પ્રકાશ

શ્રી સત્પંથ બાલ-બાલિકા સુસંસ્કાર શિક્ષણ શિબિર અંક

પ્રેરણાપીઠ-પીરાણા (તા. ૧૬-૫-૨૦૧૯ થી તા. ૨૬-૫-૨૦૧૯)

શ્રી સત્પંથ બાલ-બાલિકા સુસંસ્કાર શિક્ષણ શિબિર

શ્રી સત્પંથ બાલ-બાલિકા સુસંસ્કાર શિક્ષણ શિબિર પ્રસંગે દિપ પ્રાગટ્ય કરી રહેલ
પ.પૂ. જગદ્ગુરુશ્રી સત્પંથાચાર્ય નાનકદાસજી મહારાજ, પૂ. મહંતશ્રીઓ, પૂ. સંતો તથા ટ્રસ્ટીશ્રીઓ

છૂટક કિંમત : ૯=૦૦ રૂ. / વા. લ. ૧૦૦=૦૦ રૂ.

realpatidar.com

https://archive.org/details/bk1418/page/n3/mode/1up

realpatidar.com

Gyaneshwar / Gangaram Kaka at Umiya Mataji Uniha

મહંતશ્રી જ્ઞાનેશ્વરદાસજી મહારાજ-પ્રેરણ ... જનાર્દન હરીજી મહારાજ-ફૈજપુર મહારાષ્ટ્ર, સંતશ્રી પ્રેમદાસબાપુ-પંચવટી અમેરીક ... શ્રીઓ તેમજ સમાજના અગ્રણી આગેવાનો ઉમિયા માતાજી ... કાતે ગયા હતા ત્યારે ઉમિયા માતાજી સંસ્થાના પ્રમુખશ્રી મણીભાઈ મમ્મી તથા સંસ્થાના મહામંત્રીશ્રી નેતાજીએ ઉમળકાભેર સ્વાગત કર્યું હતું

યોગ તપોનિષ્ઠ પરમપૂજ્ય સંતશ્રી પ્રેમદાસબાપુ પ્રેરીત યોગ સાધના તજ્જ્ઞ તાલીમશિબિર વર્ગ પ્રેરણાપીઠ પીરાણા ખાતે યોજાઈ ગયેલ (તા. ૨૬-૫-૨૦૧૯ થી ૨૯-૫-૨૦૧૯)

Yog Sadhana Talim Shibir

realpatidar.com

Bal - Balika Shibir

realpatidar.com

શ્રી સત્પંથ બાલ-બાલિકા સુસંસ્કાર શિક્ષણ શિબિર

પ્રેરણાપીઠ-પીરાણા (તા. ૧૬-૫-૨૦૧૯ થી તા. ૨૬-૫-૨૦૧૯)

આશીર્વચન આપતા પ.પૂ. જગદ્‌ગુરુશ્રી સત્પંથાચાર્ય નાનકદાસજી મહારાજ, પૂ. મહંતશ્રીઓ, પૂ. સંતો તથા ટ્રસ્ટીશ્રીઓ

realpatidar.com

https://archive.org/details/bk1418/page/n5/mode/1up

realpatidar.com

શ્રી સત્પંથ બાલ-બાલિકા સુસંસ્કાર શિક્ષણ શિબિર

પ્રેરણાપીઠ-પીરાણા (તા. ૧૬-૫-૨૦૧૯ થી તા. ૨૬-૫-૨૦૧૯)

શ્રી સત્પંથ બાલ-બાલિકાઓને સુસંસ્કારનું શિક્ષણ આપતા મહાનુભાવો તથા ટ્રસ્ટીશ્રીઓ

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

realpatidar.com

શ્રી સત્પંથ બાલ-બાલિકા સુસંસ્કાર શિક્ષણ શિબિર

પ્રેરણાપીઠ-પીરાણા (તા. ૧૬-૫-૨૦૧૯ થી તા. ૨૬-૫-૨૦૧૯)

શ્રી સત્પંથ બાલ-બાલિકાઓને સુસંસ્કારનું શિક્ષણ આપતા શિક્ષણગણ તથા મુખ્ય સંચાલકો અને સહાયકશ્રીઓ

realpatidar.com

https://archive.org/details/bk1418/page/n7/mode/1up

realpatidar.com

શ્રી સત્પંથ બાલ-બાલિકા સુસંસ્કાર શિક્ષણ શિબિર

પ્રેરણાપીઠ-પીરાણા (તા. ૧૬-૫-૨૦૧૯ થી તા. ૨૬-૫-૨૦૧૯)

દિવ્યોમંત્રોનો અભ્યાસ કરતાં કુટીરના શિબિરાર્થીઓ બાલમિત્રોની મુલાકાતે સંતો, ટ્રસ્ટીઓ તથા સંચાલકશ્રીઓ

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

realpatidar.com

શ્રી સત્પંથ બાલ-બાલિકા સુસંસ્કાર શિક્ષણ શિબિર

પ્રેરણાપીઠ-પીરાણા (તા. ૧૬-૫-૨૦૧૯ થી તા. ૨૬-૫-૨૦૧૯)

દિવ્યોમંત્રોનો અભ્યાસ કરતાં કુટીરના શિબિરાર્થીઓ બાલમિત્રોની મુલાકાતે સંતો, ટ્રસ્ટીઓ તથા સંચાલકશ્રીઓ

realpatidar.com

realpatidar.com

શ્રી સત્પંથ બાલ-બાલિકા સુસંસ્કાર શિક્ષણ શિબિર

પ્રેરણાપીઠ-પીરાણા (તા. ૧૬-૫-૨૦૧૯ થી તા. ૨૬-૫-૨૦૧૯)

દિવ્યમંત્રોનો અભ્યાસ કરતાં કુટીરના શિબિરાર્થી બાલમિત્રોની મુલાકાતે, કુટીરના તજજ્ઞને શિબિરાર્થીના પ્રમાણપત્ર અર્પણ કરતાં અશોકભાઈ તથા સેવક મણીબાપા તથા મહારજશ્રીના આશીર્વાદ લેતા કચ્છના તજજ્ઞ મિત્રો

realpatidar.com

https://archive.org/details/bk1418/page/n10/mode/1up

realpatidar.com

શ્રી સત્પંથ બાલ-બાલિકા સુસંસ્કાર શિક્ષણ શિબિર

પ્રેરણાપીઠ-પીરાણા (તા. ૧૬-૫-૨૦૧૯ થી તા. ૨૬-૫-૨૦૧૯)

વિશિષ્ટ, પરમવિશિષ્ટ અને તેજસ્વી શિબિરાર્થી બાલ-મિત્રોને વિશિષ્ટ પદ કાર્ડ અર્પણ કરી રહેલ

પ.પૂ. જગદ્‌ગુરુશ્રી સત્પંથાચાર્ય નાનકદાસજી મહારાજ

realpatidar.com

https://archive.org/details/bk1418/page/n11/mode/1up

realpatidar.com

શ્રી સત્પંથ બાલ-બાલિકા સુસંસ્કાર શિક્ષણ શિબિર

પ્રેરણાપીઠ-પીરાણા (તા. ૧૬-૫-૨૦૧૯ થી તા. ૨૬-૫-૨૦૧૯)

વિશિષ્ટ, પરમવિશિષ્ટ અને તેજસ્વી શિબિરાર્થી બાલ-મિત્રોને વિશિષ્ટ પદ કાર્ડ અર્પણ કરી રહેલ
પ.પૂ. જગદ્ગુરુશ્રી સત્પંથાચાર્ય નાનકદાસજી મહારાજ તથા સંતશ્રી છગનબાપા

realpatidar.com

https://archive.org/details/bk1418/page/n12/mode/1up

realpatidar.com

શ્રી સત્પંથ બાલ-બાલિકા સુસંસ્કાર શિક્ષણ શિબિર

પ્રેરણાપીઠ-પીરાણા (તા. ૧૬-૫-૨૦૧૯ થી તા. ૨૬-૫-૨૦૧૯)

વિશિષ્ટ, પરમવિશિષ્ટ અને તેજસ્વી શિબિરાર્થી બાલ-મિત્રોને વિશિષ્ટ પદ કાર્ડ અર્પણ કરી રહેલ સંતશ્રી છગનબાપા

realpatidar.com

https://archive.org/details/bk1418/page/n13/mode/1up

realpatidar.com

શ્રી સત્પંથ બાલ-બાલિકા સુસંસ્કાર શિક્ષણ શિબિર

પ્રેરણાપીઠ-પીરાણા (તા. ૧૬-૫-૨૦૧૯ થી તા. ૨૬-૫-૨૦૧૯)

તજજ્ઞને કુટીરના શિબારાર્થી બાલમિત્રોના પ્રમાણપત્ર અર્પણ કરી રહેલ કે.વી.બાપા, મણીબાપા અને મનોજભાઈ

realpatidar.com

https://archive.org/details/bk1418/page/n14/mode/1up

realpatidar.com

શ્રી સત્પંથ બાલ-બાલિકા સુસંસ્કાર શિક્ષણ શિબિર

પ્રેરણાપીઠ-પીરાણા (તા. ૧૬-૫-૨૦૧૯ થી તા. ૨૬-૫-૨૦૧૯)

તજજ્ઞને કુટીરના શિબારાર્થી બાલમિત્રોના પ્રમાણપત્ર અર્પણ કરી રહેલ મનોજભાઈ,રમેશભાઈ ચૌધરીસાહેબ, જશુભાઈ તથા અશોકભાઈ

realpatidar.com

https://archive.org/details/bk1418/page/n15/mode/1up

realpatidar.com

શ્રી સત્પંથ બાલ-બાલિકા સુસંસ્કાર શિક્ષણ શિબિર

પ્રેરણાપીઠ-પીરાણા (તા. ૧૬-૫-૨૦૧૯ થી તા. ૨૬-૫-૨૦૧૯)

શિબિરના સંચાલકશ્રી, પ્રબંધકો તથા મુખ્ય શિબિર સંચાલક ચેતનભાઈ પટેલનો સન્માન કરી રહેલ જગદ્‌ગુરુ સંતપંથાચાર્ય નાનકદાસજી મહારાજ

realpatidar.com

https://archive.org/details/bk1418/page/n16/mode/1up

realpatidar.com

શ્રી સત્પંથ બાલ-બાલિકા સુસંસ્કાર શિક્ષણ શિબિર

પ્રેરણાપીઠ-પીરાણા (તા. ૧૬-૫-૨૦૧૯ થી તા. ૨૬-૫-૨૦૧૯)

સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લઈ રહેલ વિવિધ કુટીરના બાલમિત્રો

realpatidar.com

https://archive.org/details/bk1418/page/n17/mode/1up

realpatidar.com

શ્રી સત્પંથ બાલ-બાલિકા સુસંસ્કાર શિક્ષણ શિબિર

પ્રેરણાપીઠ-પીરાણા (તા. ૧૬-૫-૨૦૧૯ થી તા. ૨૬-૫-૨૦૧૯)

બાલમિત્રોની શિબિર સમાપન પ્રસંગે વાલીઓ તથા વિવિધ કુટીરોના શિબિરાર્થી બાલમિત્રો સ્ટેજ પર આવી દિવ્ય મંત્રો બોલી પ્રતિભાવો આપે છે

realpatidar.com

https://archive.org/details/bk1418/page/n18/mode/1up

realpatidar.com

શ્રી સત્પંથ બાલ-બાલિકા સુસંસ્કાર શિક્ષણ શિબિર

પ્રેરણાપીઠ-પીરાણા (તા. ૧૬-૫-૨૦૧૯ થી તા. ૨૬-૫-૨૦૧૯)

શિબિરમાં બાલમિત્રોને કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ

realpatidar.com

https://archive.org/details/bk1418/page/n19/mode/1up

realpatidar.com

શ્રી સત્પંથ બાલ-બાલિકા સુસંસ્કાર શિક્ષણ શિબિર

પ્રેરણાપીઠ-પીરાણા (તા. ૧૬-૫-૨૦૧૯ થી તા. ૨૬-૫-૨૦૧૯)

શિબિર દરમ્યાન શિબિરાર્થી બાલમિત્રોને સંસ્થા પરીચય

realpatidar.com

https://archive.org/details/bk1418/page/n20/mode/1up

realpatidar.com

શ્રી સત્પંથ બાલ-બાલિકા સુસંસ્કાર શિક્ષણ શિબિર

પ્રેરણાપીઠ-પીરાણા (તા. ૧૬-૫-૨૦૧૯ થી તા. ૨૬-૫-૨૦૧૯)

શિબિરમાં સંગીત-કલાવૃંદ ટીમ, કચ્છથી આવેલ તજ્જ્ઞ ટીમ,

સિધ્ધી વિનાયક મંદીરની મુલાકાત, પીરાણાલાટના સેવાભાવિ મિત્રો તથા મુખ્ય સંચાલકશ્રી



realpatidar.com

https://archive.org/details/bk1418/page/n21/mode/1up

realpatidar.com

મહારાષ્ટ્રમાં પુના-દૌડ, ગુજરાતમાં અંકલેશ્વર-ભરૂચમાં સત્સંગના પ્રોગ્રામમાં હાજરી આપેલ મહંતશ્રી જ્ઞાનેશ્વરદાસજી મહારાજ, મહંતશ્રી જયરામદાસજી મહારાજ, સંતશ્રી પંકજદાસજી મહારાજ તથા ટ્રસ્ટીશ્રી પશાબાપા



પ.પૂ. મહામંડલેશ્વર જર્નાદન હરીજી મહારાજના સાનિધ્યમાં જ્ઞાન શિબિર

(સદ્‌ગુરુ ઈમામશાહ મહારાજનું જીવન ચરિત્ર)

આયોજીત ગાંધીનગર, અમદાવાદ, દહેગામસત્પંથ યુવા પરીવાર, ગામ-ભાડજ, (તા.૧૫/૧૬-૬-૨૦૧૯)

realpatidar.com

https://archive.org/details/bk1418/page/n22/mode/1up

2019-07 -Satpanth Prakash (1418)

સત્પંથ પ્રકાશ

વર્ષ : ૮, અંક : ૭, સળંગ અંક : ૧૦૩, જુલાઈ - ૨૦૧૯

:: સ્થાપકશ્રી ::
શ્રી શામજીભાઈ કે. પટેલ - વડાગામ

:: સંપાદકશ્રી ::
શ્રી શાંતિભાઈ ડી. પટેલ - મુંબઈ

:: સત્પંથ પ્રકાશન સમિતિ ::

:: પ્રમુખશ્રી ::
શ્રી મનોજભાઈ એન. પટેલ - વડોદરા

:: મંત્રીશ્રી ::
શ્રી જશુભાઈ કે. પટેલ - વિઠ્ઠલપુરા લાટ

:: સહ મંત્રીશ્રી ::
શ્રી સુરેશભાઈ એમ. પટેલ - અમદાવાદ

:: સદસ્યશ્રીઓ ::
પ્રિ. શ્રી સુરેશભાઈ એસ. પટેલ - ખેડબ્રહ્મા
શ્રી જેઠાલાલ કે. સેંઘાણી - માંડવી
શ્રી નારણભાઈ ડી. પટેલ - પૂના
શ્રી અંબાલાલ પી. પટેલ - રામાપીરકંપા
શ્રી અમૃતલાલ જે. રૂડાણી - નાના અંગીયા
શ્રી હર્ષદકુમાર જે. પટેલ - પીરાણા લાટ

:: સલાહકારશ્રીઓ ::
શ્રી સામજીભાઈ એલ. ધોળુ - વડોદરા
શ્રી કરશનભાઈ વી. પટેલ - ધનસુરા

:: સત્પંથ પ્રકાશ - લવાજમ દર ::

	ભારતમાં	વિદેશમાં
વાર્ષિક	૧૦૦=૦૦	૭૦૦=૦૦
ત્રિવાર્ષિક	૨૫૦=૦૦	૧૮૦૦=૦૦
આજીવન (૨૫ વર્ષ)	૮૫૦=૦૦	૪૦૦૦=૦૦

:: પ્રકાશક ::
સત્પંથ પ્રકાશન સમિતિ,
પ્રેરણાપીઠ-પીરાણા, તા. દસક્રોઈ, જિ. અમદાવાદ-૩૮૨૪૨૫.

E-mail : satpanthprakash@gmail.com

Website : www.nishklankinarayan.com

કુરીયર્સ : મારૂતિ કુરીયર્સ, બારેજા - અમદાવાદ.
C/o. સત્પંથ પ્રકાશન સમિતિ, પ્રેરણાપીઠ-પીરાણા.

સંપર્ક : પ્રકાશન ઓફિસ પ્રેરણાપીઠ, પીરાણા મો. ૯૭૨૪૯૭૬૦૦૬
ચેતન પટેલ - પ્રકાશન ઓફિસ મો. ૯૪૨૮૭૬૮૭૮૭
ધર્મેન્દ્ર પટેલ - બુક સ્ટોલ મો. ૮૧૪૧૬૭૦૨૪૦

ડીઝાઈન : મનીષકુમાર કોષ્ટી - અમદાવાદ. (મો.) ૭૮૭૪૮૫૦૨૮૨
કુમકુમ ગ્રાફીક્સ, શીવ ચેમ્બર્સ, સી.ટી.એમ., અમદાવાદ-૨૬.

મુદ્રક : સનરાઈઝ પ્રિન્ટર્સ : જી-૬, રવિ એસ્ટેટ, રૂસ્તમ મિલ કંપાઉન્ડ, ઓ.આર.ટી.એસ. બસ સ્ટોપ સામે, દુધેશ્વર, અમદાવાદ-૩૮૦૦૦૪, મો. ૯૮૨૪૨૫૩૮૫૩

મૂળ ક્રમ : વર્ષ : ૨૭ સળંગ અંક : ૩૦૯

પ્રાર્થના

હે નિષ્કલંકી નાથ !

અમારા જીવન રથને તું હંકારજે,
સારથી બનીને તેને તું સંભાળજે
અમે "પામર" અમારા રથને તું ચલાવજે,
અમારી નાડ તારે હાથ સંભાળજે.
અર્જુનનો તું સારથિ, અમારા રથને ચલાવજે,
સતપંથીનો હાથ ઝાલી રથમાં બેસાડજે.
અમારી નાડ તારે હાથ તું સંભાળજે,
તું અમારો નિષ્કલંકી નાથ! ભવસાગર તરાવજે.
ભક્તોની પ્રાર્થના સુણી રથને હંકારજે,
સતપંથીનો જીવનરથ સારથિ બની ચલાવજે.
હૃદયની પ્રાર્થના છે હે નાથ !
અમારો જીવનરથ ચલાવજે.

●●●

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk1418/page/n23/mode/1up

2019-07 -Satpanth Prakash (1418)

realpatidar.com

સદ્‌ગુરુ શ્રી ઈમામશાહ મહારાજ રચિત

"શ્રીમદ્‌ ભગવત્‌ દશાવતાર"

(શ્રી રામ અવતાર)

(ગતાંકથી ચાલું)

Satpanth Religious Literature - Shrimad Bhagwat Dashavatar written by Imamshah

એક મોજડી નથી. આજુબાજુમાં ઘણું જોયું, પણ એક મોજડી દેખાતી નહોતી. તારામતિ અને સર્વ જણ આશ્ચર્યચકિત થઈ ગયાં, હવે શું કરવું એની ચિંતા કરવા લાગ્યાં. પછી તારામતિએ જ કહ્યું, આપણી સાક્ષાત્‌ જાગૃત પૂજાવસ્થામાં જ આપણે આરાધના કરીએ. એમ કહીને બધાં અંદર ગયા.

તારામતિ મનોભાવથી આરાધના કરવા લાગી: હે સ્વામી ! આજે મારી લાજ જવાનો સમય આવ્યો છે. મોજડીની કિંમત નહીં પણ એ યોગથી મારા ઉપર સંકટ આવી પડશે. રાજાને આ વાત જણાતા જ મારા કુળ-શીલ અને ગુણ વગેરે ચારિત્ર્યને કાળીમા લાગશે અને દેવસભાની ગુપ્તતા રહેશે નહીં. પ્રભુ ! પૂર્વકાળમાં તમે અંબરિષ, રૂખ્માંગદ, ધ્રુવ, પ્રહલાદ વગેરે સદ્‌ભક્તોનાં ઘણાં જ કાર્યો કરીને એમને સંકટમુક્ત કરીને અમર કર્યા. હું પણ પામર તમારી એ ક્ષુદ્ર દાસી મનોભાવથી તમારા શરણે આવી છું. મારા શીલ રક્ષણ માટે મારા ઉપર કૃપા કરો.'

રાણી એવી કલ્પાંત ભરી વિનંતી કરે છે ત્યાં જ એક કુદરતી મોજડી અંતરીક્ષમાંથી નીચે આવી. તે પહેલી મોજડી જેવી જ એકદમ બરાબર જોડીની મોજડી જોઈને રાજા હરિશ્ચંદ્ર તો આશ્ચર્યચકિત થઈ ગયા. પછી બધી ગત્‌ગંગાને પણ આનંદ થયો. હર્ષ અને પ્રેમપૂર્વક અંતઃકરણથી તારામતિએ ગત્‌ગંગાને ફરી પ્રણામ કર્યા. ત્વરીત ત્યાંથી એ ઘોડા પાસે આવી.

તારામતિના પિતા તેને આશીર્વાદ આપવા માટે ત્યાં આવ્યા. વારંવાર ફરી ફરીને તારામતિને જોઈને અત્યંત ગદ્‌ગદ્‌ પ્રેમાળ વાણીથી બોલ્યા: 'હે પુત્રી ! તારું રક્ષણ પરમેશ્વર કરે. તારી સેવા સાર્થક હો, ધન્ય ભાગ્ય મારાં કે તારા જેવી કન્યારત્ન મને મળી. ધન્ય ભાગ્ય હરિશ્ચંદ્ર રાજાને કે કુલતારણ સતી તેને મળી, પોતાના ગુણોથી અને સેવાથી અમને બધાંને સંતોષિત કર અને પોતાની સાથે બધાંની ઉદ્ધારક હો.' અતિશય પ્રેમથી સ્નેહાર્દ્રતાથી આશીર્વાદ આપીને આંખોનાં આંસુ લૂછીને વીરલોચન આશ્રમમાં ગયા.

એ કરુણ દશ્ય જોઈને હરિશ્ચંદ્ર પણ દ્રવી ગયા. પણ હવે આગળ શું થાય છે એ જિજ્ઞાસાથી અને આતુરતાથી એ જોવા લાગ્યા. સર્વ જણ દષ્ટિથી દૂર થતાં જ રાણી ઘોડા પર સવાર થઈ ગઈ. એટલામાં હરિશ્ચંદ્ર પણ ઝાડ ઉપરથી નીચે ઉતરીને રાણીની પાછળ પાછળ જવા લાગ્યા. ઘોડો વાયુવેગે નીકળી ગંગા તીરે આવ્યો. પૂર્વ પ્રમાણે ગંગાએ તેને વાટ કરી આપી. પછી નગરના મુખ્ય સપ્ત દ્વાર પાસે આવતાં જ દરવાજા આપોઆપ ઉઘડી ગયા. રાણીએ અંદર પ્રવેશ કરતાં જ દરવાજા પૂર્વવત બંધ થયા. પછી અશ્વશાળામાં જઈને રાણીએ પલાણ વગેરે ઉતારી ઘોડાને બાંધ્યો.

એટલા સમયનો ફાયદો લઈને રાજા પોતાના મહેલમાં જઈને પલંગ ઉપર સૂઈ ગયો. થોડી વાર પછી તારામતિએ આવીને જોયું કે રાજા હજુ ઊંઘે છે. નિરાંતનો એક શ્વાસ લઈ તે પોતાના ઓરડામાં ગઈ. કુમાર રોહિદાસ માટે લાવેલ પ્રસાદનો થાળ તેણે ખૂણામાં મૂકી શયન મંદિરમાં આવી. પૂજાનો વેષ

● વ્રત બંધન નથી, પણ સ્વતંત્રતાનું દ્વાર છે ●

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

realpatidar.com

ઉતારી જાપમાળા વગેરે મૂકી રાજવેષ-શયનવેષ ધારણ કર્યો. દીવો પ્રગટ કરીને ધીમેથી રાજાના પગ પાસે બેસીને એમની ચરણ સેવા કરવા લાગી.

રાજા મનમાં ને મનમાં વિચાર કરવા લાગ્યો કે હવે શું કરવું ! રાણી તારામતિને કઈ રીતે પૂછવું એનો તે મનમાં ને મનમાં વિચાર કરવા લાગ્યો.

પછી આળસ મરડીને રાજા પલંગ પર બેઠા અને રાણીને કહ્યું: 'રાણી, મને હમણાં જ ખૂબ વિચિત્ર સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં મને એમ દેખાયું કે તું તારા પિયર ગઈ છે અને ત્યાં ઘટપાટની પૂજા કરતાં મેં તેને જોઈ.

તારારાણી તરત જ હસીને બોલીઃ 'સ્વામી, સ્વપ્નની ઘટના સત્ય જ હોય અથવા એમ જ હોય એવું નથી હોતું અને સ્વામી, અસત્ય એવાં સ્વપ્નનો તમે વિચાર સુદ્ધાં ન કરશો, એવા હીન વિચાર આવે એટલે નિષ્ક્રિયતા આવીને જીવનનો નાશ પણ થાય છે.

રાણીનાં આવાં વચન સાંભળતાં રાજાને ભયંકર ક્રોધ આવ્યો. ગુસ્સાથી એ લાલઘૂમ થઈ ગયો. તેનાં બધાં ગાત્રો થરથર કાંપવા લાગ્યાં. શ્વાસ જોરજોરથી વહેવા લાગ્યો અને તે રાણીને બોલ્યોઃ 'રાણી, અસત્ય તું બોલીને મને તું અસત્ય ઠેરવે છે? આ જો તલવાર ! આ તલવારથી તારા રાઈ રાઈ જેટલા ટુકડા કરીને પશુ આગળ નાખીશ ! સાચું કહે રાત્રે તું શ્યામકર્ણ ઘોડો લઈને ક્યાં ગઈ હતી ? તું તારા પિયર ગઈ હતી કે નહીં ? તું ધ્યાન રાખ. આજથી ઘરની બહાર પગ મૂક્યો તો આ તલવારથી તારો ઘાત કરીશ. દાસીએ મને સત્ય કથન કહ્યું હતું એ મેં પ્રત્યક્ષ જોયું અને મને અસત્યપણાની કાલીમા લગાવે છે?'

તારામતિ આજીજી કરીને બોલીઃ 'સ્વામી, તમે દાસીનું વચન સત્ય માનીને મારા ઉપર આવો આરોપ કરો છો. તમે મારા ઉપર શસ્ત્ર ઉગામશો તો હું તત્કાળ મારા શિર પર સહન કરીશ, પણ આ અબળા પર આવો આળ આપીને કલંકિત કરશો નહીં.'

રાણીનાં આ વચન સાંભળીને રાજાને અધિક ક્રોધ ચડયો. અત્યંત ક્રોધિત થઈને તેણે રાણીને પૂછ્યું કેઃ 'હું કહું છું એ તને આળ લાગે છે ? હે રાણી, મને તું અસત્ય ઠેરવે છે ? પણ યાદ રાખ ! તારાં બધાં પાપોનો ઘડો આજે ભરાઈ ગયો છે એ નિશ્ચિત સમજ. હું પ્રત્યક્ષ જોઈને જ તને કહું છું, કોઈના પણ વચન પર વિશ્વાસ કરીને તને દોષ આપતો નથી, મને જે પ્રત્યક્ષ દેખાયું, અનુભવ્યું તેના ઉપરથી જ મેં તને સત્ય પૂછ્યું છે. રાજાનું વચન સાંભળીને રાણીને વિચાર થયો કે હવે શું કરવું ? સર્વ સત્ય કથન કરવાથી દેવસભાની ગુપ્તતા રહેશે નહીં અને રાજા એ બધી વાતનો છેડો લગાવીને દેવસભાને ઉધ્વંસ કરી નાખશે. આ બીકથી ચૂપ થઈ અને તે મનોમન ત્રિભુવનપતિને વિનંતી કરવા લાગી.

રાજાનાં એ કઠોર વચન સાંભળી રાણીને ખૂબ દુ:ખ લાગ્યું. પ્રાણ જાય તો વાંધો નહીં, શરીરના ટુકડા થાય તો પણ વાંધો નહીં પણ દેવસભાનું ગુપ્તત્વ અબાધિત રહે એવું રાણીને લાગતું હતું. રાજાની આજ્ઞા પણ ઉથલાવાય નહીં. તેથી શું કરવું એમ રાણી મનમાં વિચાર કરતી હતી.

રાજાએ થાળ જોઈને મનમાં કંઈક ગેરસમજ કરી લીધી તો મોટો અનર્થ થશે માટે તેણે ભગવાનની મનોમન આરાધના શરૂ કરી. છેડો પાથરીને તેણે ભગવાનને પ્રાર્થનાપૂર્વક વિનંતી કરી કેઃ 'હે સ્વામી, જગન્નિયંતા હવે મારી નહીં પણ તારી જ લાજ જવાનો સમય આવ્યો છે. હું તો કિંચિત તારી દાસી છું. તારા સેવકોનું રક્ષણ કરવા હે ભગવાન ! તું જ દોડી આવ. હે શ્રી રામ ! તું જલ્દી પ્રગટ થઈને આ દાસીની આબરૂનું રક્ષણ કર. ગદ્ગદીત વાણીથી તારામતિ ભગવાનની આરાધના કરે છે, નયનમાં આંસુની એક સરખી ધારા વહે છે.

(વધુ આવતાં અંકે)

●●●

realpatidar.com

realpatidar.com

શ્રી સત્પંથ બાલ-બાલિકા સુસંસ્કાર શિક્ષણ શિબિર

પ્રેરણાપીઠ-પીરાણા (તા. ૧૬-૫-૨૦૧૯ થી તા. ૨૬-૫-૨૦૧૯)

બાલિકાની શિબિરમાં ઉદ્‌ઘાટન પ્રસંગે ઉપસ્થિત જગદ્‌ગુરુ સત્પંથાચાર્યશ્રી નાનકદાસજી મહારાજ, સંતો-મહંતો તથા મહાનુભાવા તથા ટ્રસ્ટીઓ

૬૬

realpatidar.com

https://archive.org/details/bk1418/page/n26/mode/1up

realpatidar.com

શ્રી સત્પંથ બાલ-બાલિકા સુસંસ્કાર શિક્ષણ શિબિર

પ્રેરણાપીઠ-પીરાણા (તા. ૧૬-૫-૨૦૧૯ થી તા. ૨૬-૫-૨૦૧૯)

દિવ્યોમંત્રોનો અભ્યાસ કરતી કુટીરની શિબિરાર્થી બાલિકાની મુલાકાતે સંતો, ટ્રસ્ટીઓ તથા સંચાલકશ્રીઓ

realpatidar.com

https://archive.org/details/bk1418/page/n27/mode/1up

realpatidar.com

શ્રી સત્પંથ બાલ-બાલિકા સુસંસ્કાર શિક્ષણ શિબિર

પ્રેરણાપીઠ-પીરાણા (તા. ૧૬-૫-૨૦૧૯ થી તા. ૨૬-૫-૨૦૧૯)

દિવ્યોમંત્રોનો અભ્યાસ કરતી કુટીરની શિબિરાર્થી બાલિકાની મુલાકાતે સંતો, ટ્રસ્ટીઓ તથા સંચાલકશ્રીઓ

realpatidar.com

https://archive.org/details/bk1418/page/n28/mode/1up

realpatidar.com

શ્રી સત્પંથ બાલ-બાલિકા સુસંસ્કાર શિક્ષણ શિબિર

પ્રેરણાપીઠ-પીરાણા (તા. ૧૬-૫-૨૦૧૯ થી તા. ૨૬-૫-૨૦૧૯)

દિવ્યોમંત્રોનો અભ્યાસ કરતી કુટીરની શિબિરાર્થી બાલિકાની મુલાકાતે સંતો, ટ્રસ્ટીઓ તથા સંચાલકશ્રીઓ

realpatidar.com

https://archive.org/details/bk1418/page/n29/mode/1up

realpatidar.com

શ્રી સત્પંથ બાલ-બાલિકા સુસંસ્કાર શિક્ષણ શિબિર

પ્રેરણાપીઠ-પીરાણા (તા. ૧૬-૫-૨૦૧૯ થી તા. ૨૬-૫-૨૦૧૯)

વિશિષ્ટ, પરમવિશિષ્ટ અને તેજસ્વી શિબિરાર્થી બાલિકાઓને વિશિષ્ટ પદ કાર્ડ અર્પણ કરી રહેલ
પ.પૂ. જગદ્‌ગુરુ સત્પંથાચાર્યશ્રી નાનકદાસજી મહારાજ

realpatidar.com

https://archive.org/details/bk1418/page/n30/mode/1up

realpatidar.com

શ્રી સત્પંથ બાલ-બાલિકા સુસંસ્કાર શિક્ષણ શિબિર

પ્રેરણાપીઠ-પીરાણા (તા. ૧૬-૫-૨૦૧૯ થી તા. ૨૬-૫-૨૦૧૯)

વિશિષ્ટ, પરમવિશિષ્ટ અને તેજસ્વી શિબિરાર્થી બાલિકાઓને વિશિષ્ટ પદ કાર્ડ અર્પણ કરી રહેલ
પ.પૂ. જગદ્‌ગુરુ સત્પંથાચાર્યશ્રી નાનકદાસજી મહારાજ

realpatidar.com

https://archive.org/details/bk1418/page/n31/mode/1up

realpatidar.com

શ્રી સત્પંથ બાલ-બાલિકા સુસંસ્કાર શિક્ષણ શિબિર

પ્રેરણાપીઠ-પીરાણા (તા. ૧૬-૫-૨૦૧૯ થી તા. ૨૬-૫-૨૦૧૯)

વિશિષ્ટ, પરમવિશિષ્ટ અને તેજસ્વી શિબિરાર્થી બાલિકાઓને વિશિષ્ટ પદ કાર્ડ અર્પણ કરી રહેલ
પ.પૂ. જગદ્ગુરુ સત્પંથાચાર્યશ્રી નાનકદાસજી મહારાજ

realpatidar.com

realpatidar.com

શ્રી સત્પંથ બાલ-બાલિકા સુસંસ્કાર શિક્ષણ શિબિર

પ્રેરણાપીઠ-પીરાણા (તા. ૧૬-૫-૨૦૧૯ થી તા. ૨૬-૫-૨૦૧૯)

વિશિષ્ટ, પરમવિશિષ્ટ અને તેજસ્વી શિબિરાર્થી બાલિકાઓને વિશિષ્ટ પદ કાર્ડ અર્પણ કરી રહેલ પ.પૂ. જગદ્‌ગુરુ સત્પંથાચાર્યશ્રી નાનકદાસજી મહારાજ, મહંતશ્રી જ્ઞાનેશ્વર મહારાજ અને સંતશ્રી પંકજદાસજી તથા શિબિર સંચાલકશ્રી

realpatidar.com

https://archive.org/details/bk1418/page/n33/mode/1up

realpatidar.com

શ્રી સત્પંથ બાલ-બાલિકા સુસંસ્કાર શિક્ષણ શિબિર

પ્રેરણાપીઠ-પીરાણા (તા. ૧૬-૫-૨૦૧૯ થી તા. ૨૬-૫-૨૦૧૯)

તજજ્ઞને કુટીરના શિબારાર્થી બાલિકાઓને પ્રમાણપત્ર અર્પણ કરી રહેલ સંતશ્રી પ્રેમદાસબાપુ

realpatidar.com

https://archive.org/details/bk1418/page/n34/mode/1up

realpatidar.com

શ્રી સત્પંથ બાલ-બાલિકા સુસંસ્કાર શિક્ષણ શિબિર

પ્રેરણાપીઠ-પીરાણા (તા. ૧૬-૫-૨૦૧૯ થી તા. ૨૬-૫-૨૦૧૯)

તજજ્ઞને કુટીરના શિબારાર્થી બાલિકાઓને પ્રમાણપત્ર અર્પણ કરી રહેલ સંતશ્રી પ્રેમદાસબાપુ, મહંતશ્રી પરસોત્તમદાસજી મહારાજ, સંતશ્રી પંકજદાસજી મહારાજ

realpatidar.com

https://archive.org/details/bk1418/page/n35/mode/1up

realpatidar.com

શ્રી સત્પંથ બાલ-બાલિકા સુસંસ્કાર શિક્ષણ શિબિર

પ્રેરણાપીઠ-પીરાણા (તા. ૧૬-૫-૨૦૧૯ થી તા. ૨૬-૫-૨૦૧૯)

તજજ્ઞને કુટીરના શિબારાર્થી બાલિકાઓને પ્રમાણપત્ર અર્પણ કરી રહેલ સંતશ્રી પંકજદાસજી મહારાજ, મહંતશ્રી શામળદાસજી મહારાજ તથા સવદાસબાપા

realpatidar.com

https://archive.org/details/bk1418/page/n36/mode/1up

realpatidar.com

શ્રી સત્પંથ બાલ-બાલિકા સુસંસ્કાર શિક્ષણ શિબિર

પ્રેરણાપીઠ-પીરાણા (તા. ૧૬-૫-૨૦૧૯ થી તા. ૨૬-૫-૨૦૧૯)

તજજ્ઞને કુટીરના શિબારાર્થી બાલિકાઓને પ્રમાણપત્ર અર્પણ કરી રહેલ મહંતશ્રી શામળદાસજી મહારાજ, મહંતશ્રી જ્ઞાનેશ્વરદાસજી મહારાજ, સંતશ્રી પ્રેમદાસબાપુ, મહંતશ્રી પરસોત્તમદાસજી મહારાજ

realpatidar.com

realpatidar.com

શ્રી સત્પંથ બાલ-બાલિકા સુસંસ્કાર શિક્ષણ શિબિર

પ્રેરણાપીઠ-પીરાણા (તા. ૧૬-૫-૨૦૧૯ થી તા. ૨૬-૫-૨૦૧૯)

સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લઈ રહેલ વિવિધ કુટીરના બાલિકાઓ

realpatidar.com

https://archive.org/details/bk1418/page/n38/mode/1up

realpatidar.com

શ્રી સત્પંથ બાલ-બાલિકા સુસંસ્કાર શિક્ષણ શિબિર

પ્રેરણાપીઠ-પીરાણા (તા. ૧૬-૫-૨૦૧૯ થી તા. ૨૬-૫-૨૦૧૯)

સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લઈ રહેલ વિવિધ કુટીરના બાલિકાઓ

realpatidar.com

realpatidar.com

શ્રી સત્પંથ બાલ-બાલિકા સુસંસ્કાર શિક્ષણ શિબિર

પ્રેરણાપીઠ-પીરાણા (તા. ૧૬-૫-૨૦૧૯ થી તા. ૨૬-૫-૨૦૧૯)

સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લઈ રહેલ વિવિધ કુટીરના બાલિકાઓ

realpatidar.com

https://archive.org/details/bk1418/page/n40/mode/1up

realpatidar.com

શ્રી સત્પંથ બાલ-બાલિકા સુસંસ્કાર શિક્ષણ શિબિર

પ્રેરણાપીઠ-પીરાણા (તા. ૧૬-૫-૨૦૧૯ થી તા. ૨૬-૫-૨૦૧૯)

શિબિરમાં બાલિકા દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ

realpatidar.com

realpatidar.com

શ્રી સત્પંથ બાલ-બાલિકા સુસંસ્કાર શિક્ષણ શિબિર

પ્રેરણાપીઠ-પીરાણા (તા. ૧૬-૫-૨૦૧૯ થી તા. ૨૬-૫-૨૦૧૯)

શિબિર દરમ્યાન શિબિરાર્થી બાલિકાઓને સંસ્થા પરીચય

realpatidar.com

realpatidar.com
@ Bili Atladra Road, Vadodara
AAVKAR
BUNGALOWS
3 BHK
Luxury Bungalows
@ Sama Savli Road, Vadodara
AASHIRWAD
RESIDENCY
2-3 BHK FLATS
3-4 BHK PENTHOUSES
SHOPES
a project by
AVADH
GROUP
With Best Compliments From
Mohanbhai Patel : 9825023810
Dineshbhai Patel : 9426549747 | Ramanbhai Patel : 9825019402
Nareshbhai Patel : 7574073548 | Jayantibhai Patel : 9427032051
With Best Compliments From
AADITYA
RESIDENCY - 2
Vadodara
2BHK FLATS
AADITYA
GROUP
Aaditya Residency-2,
Opp. Dream Castle, B/h. Gayatri Party Plot,
Nr. Gotri Old Jakat Naka, Gotri, Vadodara.
M.: 76001 89597 , 94260 75145
•Kitchen •Bedroom •Bathroom •Swimming Pool
With best compliments
from
Homeplus
elements for home
JAY SALES CORPORATION
ARAN
SIEMENS
Built in Appliances
HunterDouglas
PALLADIO
LATICRETE
piccolo
BOSCH
smartlife
GF-13, Vardhman Resi-Com. Plaza, Subhanpura Main Road, Subhanpura, Vadodara - 23.
Phone : 0265 - 2391230, 2390026. Mail : info@homeplusgroup.in Web : www.homeplusgroup.in
realpatidar.com
CS

realpatidar.com

હાર્દિક શુભેચ્છા સહ...

સતપંથ પરિવાર, હરણી, વડોદરા

પટેલ સો મીલ	અશોકભાઈ	9998321051
	મહેશભાઈ	9428881708
સત્યમ પ્લાયવુડ	જગદીશભાઈ	9974385051
	મણીભાઈ	9427592738
પટેલ ટીમ્બર ટ્રેડર્સ	હરીશભાઈ	9428975865
	હિંમતભાઈ	9426054665
પટેલ પ્લાયવુડ	બાબુભાઈ	9428472403
	મેહુલભાઈ	9537374745
જલારામ સો મીલ	રમેશભાઈ	9726732548
	જયંતિભાઈ	9427032051
વિશ્વકર્મા વુડ વર્કસ	દિનેશભાઈ	9825825187
	ચંદ્રેશભાઈ	8796119811
ઈશ્વર પેપર મીલ	યોગેશભાઈ	9909032327
	વેલજીભાઈ	9427538926
Personal IT Consultant	ડાહ્યાભાઈ	9724735489
	ગૌતમભાઈ	9974013335

॥ સનાતન સતપંથ ॥

With Best Compliments From

AADHYA GROUP
VADODARA

Builder & Developers

N.C. Patel	:	94283 00932
C.V. Patel	:	94270 32053
A.N. Patel	:	90999 20195
D.S. Patel	:	94265 65316
H.C. Patel	:	75677 10345
B.J. Limbani	:	97374 83022
J.C. Patel	:	78745 11311

With Best Compliments From

Orchid Group

ORCHID Calisto — 2&3 BHK LUXURIOUS FLATS

3 BHK LUXURIOUS FLATS — ORCHID FLORA

Behind Mc. Donald, Sama Savli Road, Vemali, Vadodara.

realpatidar.com

realpatidar.com

Registered under RNI No. GUJ - GUJ - 2012/42296. Dt. 18-05-2012. Registered Under Postal Registration No. GAMC - 1830/2018-2020 By S.S.P. Ahmedabad City DN Valid up to 31st December 2020. Licence to Post without Prepayment No. PMG/HQ/006/2018-2020 valid up to 31-12-2020. Posted on 15th Every Monthy from PSO Patrika Channal Ahmedabad-380002.

દર માસની ૧૫ તારીખે પ્રસિધ્ધ થતું માસિક

if not delivered please return to :

સત્પંથ પ્રકાશ
સત્પંથ પ્રકાશન સમિતિ
પ્રેરણાપીઠ, પીરાણા, તા. દસક્રોઈ,
જિ. અમદાવાદ - ૩૮૨ ૪૨૫.

Printed, and Published by **SHANTIBHAI D. PATEL on behalf of Satpanth Prakashan Samiti** and Printed at **Sunshine Printers**, G-9, Ravi Estate, Rustam Mill Compound, Opp. BRTS Gurudhwara Bus Stop, Dudheswar, Ahmedabad - 380 004 and published from Satpanth Prakashan Samiti, Shri Satpanth Prernapith, At - PIRANA - 382425, Taluka - Dascroi, Dist. Ahmedabad.
Editor - **SHANTIBHAI D. PATEL**

realpatidar.com